



AP-7510

Seat No. _____

M. A. (Part-II) Examination

March / April - 2016

Economics : Paper - VI

(International Trade and Finance)

Time : 3 Hours]

[Total Marks : 100

સૂચના : (1) આંતરિક વિકલ્પના આધારે બધા જ પ્રશ્નોના ઉત્તર આપો.
(2) દરેક પ્રશ્નના ગુણ સામે દર્શાવવામાં આવ્યા છે.

1 આંતરરાષ્ટ્રીય વ્યાપારનો તુલનાત્મક ખર્ચ તફાવતનો સિદ્ધાંત સમજાવો. ૨૦
તેનું મૂલ્યાંકન કરો.

અથવા

1 હેકશ્વર-ઓહલીનનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત સમજાવો. તેનું ૨૦
મૂલ્યાંકન કરો.

2 ભારત સરકારની વર્તમાન વિદેશ વ્યાપારનીતિ ચર્ચો. તેનું મૂલ્યાંકન કરો. ૨૦

અથવા

2 (અ) લિયોન્ટીફ વિરોધાભાસ ૧૦
(બ) વિશ્વબેંક અને ભારત ૧૦

3 વ્યાપારની શરતોને અસર કરતાં વિવિધ પરિબલો સમજાવો. ૨૦

અથવા

3 લેણદેણની તુલાનો ખ્યાલ સમજાવો. લેણદેણની તુલામાં સ્વયં સમતુલા ૨૦
કેવી રીતે આવે - સમજાવો.

4 “આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ આર્થિક વિકાસનું એન્જિન છે” - વિગતે ચર્ચા કરો. ૨૦

અથવા

4 છેલ્લા દાયકામાં ભારતના વિદેશ વ્યાપારના કદ, સ્વરૂપ અને દિશામાં આવેલા ૨૦
પરિવર્તનો ચર્ચો.

5 ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે) ૨૦

- (1) આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ
- (2) એશિયન ડેવલોપમેન્ટ બેંકની કામગીરી
- (3) આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચેનો તફાવત
- (4) અવમૂલ્યન.

ENGLISH VERSION

Instruction : (1) Give answer of all questions on the basis of internal options.

(2) Figures in the Right Side Indicates Marks.

1 Explain the comparative cost difference theory. Evaluate it. **20**
OR

1 Explain Heckscher-Ohlin's international trade theory. **20**
Evaluate it.

2 Discuss the recent foreign trade policy of Indian **20**
government. Evaluate it.

OR

2 (a) Leontief Paradox **10**

(b) World Bank and India **10**

3 Describe various factors affecting the terms of trade. **20**

OR

3 Explain the Concept of Balance of payment. Explain how **20**
the balance of payments correct automatically

4 "International trade is an engine of economic development." **20**
- Discussed in detail

OR

4 Discuss the change occurred in the direction, nature and **20**
volume of foreign trade in India, in last decades.

5 Write short notes : (Any Two) **20**

(1) International monetary Fund

(2) Function of Asian Development Bank

(3) Difference between internal trade and international trade

(4) Devaluation.